

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસે વિવિધતા, સમાનતા અને સમાવેશમાં પોતાના કામ માટે નેશનલ એવોર્ડ જીત્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 15, 2021) – આ અઠવાડિયે, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (BFES) ને વર્ષ 2021 નો ઈકિવટી, ડાઈવર્સિટી એન્ડ ઈન્કલુઝન (સમાનતા, વિવિધતા અને સમાવેશ) એવોર્ડ કેનેડિયન એસોસિએશન ઓફ ફાયર ચીફ્સ (CAFC) દ્વારા આપવામાં આવ્યો હતો. આ નવો એવોર્ડ ઉદ્યોગ આગેવાનોને ઓળખ આપે છે અને દેશભરની અગ્નિશમન સેવાઓ કેનેડાની વૈવિધ્યસભર વસ્તીને પ્રતિબિંબિત કરતી હોવાની ખાતરી કરવા કરતા કામને વખાણે છે.

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા સેવા અપાતા સમુદાયને બહુ પ્રતિબિંબિત કરતું સાંસ્કૃતિક સ્વીકૃતિ અને સમજણ ધરાવતું કાર્યબળ બનાવવા તેઓ કટિબદ્ધ છે. BFES માં વિવિધતા, સમાનતા અને સમાવેશની વૃદ્ધિ, કાઉન્સિલ સમર્પિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના 2021-2025 ફાયર માસ્ટર પ્લાનમાં મુખ્ય અગ્રતા અને ધ્યાન આપવાનું ક્ષેત્ર છે. આ પ્લાન ઓળખે છે ધ્યાન આપવાના બે મુખ્ય ક્ષેત્રોને – હયાત કાર્યબળને શિક્ષિત કરવાની અને જાગૃકતા ઊભી કરવાની જરૂરિયાત, અને વૈવિધ્યસભર, સર્વગ્રાહી અને સમાન અગ્નિશમન સેવા બનાવવા ભરતીની નવીન તકો અને બહુવિધ સાંસ્કૃતિક સમુદાયના જોડાણનું અમલીકરણ.

ચેમ્પીયન તરીકે ફાયર ચીફ બિલ બોયસ (Bill Boyes), અને ડિવિઝન ચીફ રવજોત છટવાલ (Ravjot Chhatwal) ની આગેવાનીમાં, BFES દ્વારા ડિપાર્ટમેન્ટની અંદર વિવિધતા, સમાનતા અને સમાવેશ સામે સુધારાઓને ટેકો આપવા વ્યૂહાત્મક કાર્યવાહી યોજના નીચે મુજબ બનાવવામાં આવી:

- બહુવિધ સામુદાયિક હિતધારકો, સામુદાયિક સંસ્થાઓ, નફો ન રળનારી, સાંસ્કૃતિક અને આસ્થા-આધારિત સંસ્થાઓ સાથે સલાહ-મસલત કરીને,
- શ્રેણીબદ્ધ તાલીમ તકો મારફતે BFES ટીમમાં સાંસ્કૃતિક જાગૃકતા અને સમજ વધારીને, અને
- ભરતી વ્યૂહરચના વિકસાવીને જે પરંપરાગત અવરોધો તોડે અને કાર્યબળ વધારે તીવ્ર બનાવવા મહત્વના સમુદાયો સાથે જોડાઈને વિવિધતા, સમાનતા અને સમાવેશને ટેકો આપવા કાર્ય કરે અને તેને બ્રેમ્પટનને વધારે પ્રતિબિંબિત કરતી બનાવે.

બ્રેમ્પટન એક રચના (મોઝેઈક), એક વૈવિધ્યસભર સમુદાય છે જેની માવજત કરવામાં આવે છે અને તેને વખાણવામાં આવે છે. લાંબા-ગાળાના લક્ષ્યો અને કામ જે BFES હમણાં કરી રહ્યું છે અને આગળ વધવાથી તે ભાવિ કાર્યબળ માટે એ પાયો નાખવામાં મદદરૂપ થશે જે સામુદાયિક સુરક્ષા અને સુખાકારીને ટેકો આપવાનું ચાલુ રાખતી વખતે તેઓ દ્વારા સેવા અપાતા સમુદાયને પ્રતિબિંબિત કરે.

અવતરણો (ક્વોટ્સ):

“વિવિધતા, સમાનતા અને સમાવેશના ક્ષેત્રમાં ચાલુ સુધારા માટે સમગ્ર બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ટીમની કટિબદ્ધતા બદલ તેઓને અભિનંદન. બ્રેમ્પટન એક રચના (મોઝેઈક) છે, અને એ મહત્વપૂર્ણ છે કે બધાં સમૂહોની સાથે વધારે અસરકારક રીતે પ્રવૃત્તમય થઈને અને સંવાદ કરીને આપણે તેની વિવિધતાને વખાણીએ અને સમાવેશપાણુંને પોષીએ. મને બ્રેમ્પટનના સમુદાય સાથે જોડાવા અને લાંબા-ગાળાની વૃદ્ધિ અને વિકાસ માટેની યોજનાઓ સ્થાપિત કરવા BFES દ્વારા કરતા કામનું ગૌરવ છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા કરતા કામનું અને સતત વિકાસ અને શિક્ષણ પ્રત્યે તેઓના સમર્પણ માટે હું બહુ ગૌરવ અનુભવું છું. આ એવોર્ડથી મળેલી ઓળખ પ્રમાણે, BFES ટીમને વિવિધતા, સમાનતા અને સમાવેશને સંબોધવામાં ટ્રેઈલબ્લેઝર તરીકે ઓળખ મળે છે. સેવામાં અર્થસભર ફેરફાર કરવામાં આ કટિબદ્ધતા અને જાગૃકતા, સંબંધ નિર્માણ અને શિક્ષણમાં સતત રોકાણથી ટીમ, ઉદ્યોગ અને ભવિષ્યમાં સફળતા માટે આપણાં સમુદાયને ઉપર લાવવાનું સ્થાપિત થશે.”

- રોવિના સાન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ટીમની વિવિધતા, સમાનતા અને સમાવેશ પ્રત્યે કટિબદ્ધતા જ તેઓને ઉદ્યોગમાં અને આપણાં સમુદાયમાં આગેવાનો તરીકે અલગ પાડે છે. આપણે જાણીએ છીએ કે આપણાં ધંધામાં વિવિધતા, સમાનતા અને સમાવેશને પોષવા અર્થસભર કાર્યવાહી કરીને

– આપણે એવી સંસ્થા ચલિત કરીએ છીએ જે વધારે નવીન, વ્યૂહાત્મક અને તેઓ દ્વારા સમુદાયને અપાતી સેવાને પ્રતિબિંબિત કરે છે. હું આની પર તેઓની કાર્યવાહી ચાલુ રાખવા અને આપણાં શહેર અને ફાયર સર્વિસીસને આગળ વધારવામાં આપણી બ્રેમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની અગ્રણી ટૂકડીનો આભાર માનું છું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“CAFC નો પહેલો વાર્ષિક સમાનતા, વિવિધતા અને સમાવેશ એવોર્ડ મેળવવા બદલ બ્રેમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અભિનંદન. આ એવોર્ડનો હેતુ ન કેવળ ઉત્કૃષ્ટતા વખાણવાનો, પણ તેને દેશભરમાં ફેલાવાનો પણ છે. વાચકો પૂરો કેસ અભ્યાસ વાંચી શકે છે તેમજ અન્ય લોકો વેબસાઈટ www.cafc.ca પર જોઈ શકે છે. આ ચડિયાતી કામગીરી વહેંચવા બદલ આપનો આભાર.”

- કેનેડિયન એસોસિએશન ઓફ ફાયર ચીફ્સ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca